

શિક્ષણ અને સમાજ  
કલ્યાણ કેન્દ્રનું  
માસિક મુખ પત્ર



વર્ષ : ૧૪

અંક : ૧૨

### પરદોષદર્શન

બીજાના દોષ ધારીને જોવા, તેના વિચારો કરવા અને તેમાં રાચવું, તેમજ દોષીત વ્યક્તિ માટે ઘૃણા કે તિરસ્કાર પોતાનામાં ઉદ્ભવવો, તેનાથી હું વધારે સારો તેવા મિથ્યાભિમાનમાં હરખાવું એના જેવી જીવનની બરબાદી મને બીજી કોઈ જણાઈ નથી. જાણ્યે અજાણ્યે હું પણ ઘણીવાર મારા જીવનમાં રોકાયેલો રહ્યો છું. પણ મોડે મોડે જ્યારથી હું સમજ્યો ત્યારથી એવા પ્રકારની પ્રવૃત્તિમાં સરી પડનાર મારા મનને તેમાંથી પાછું વાળવા અને બીજી કોઈ ઉંચી, રચનાત્મક અને સદાચારભરી વિચારમય પ્રવૃત્તિમાં પરોવવા હું સતત પ્રયત્નશીલ અને જાગૃત રહ્યો છું. બીજાના દોષો જ જોયા કરવાની માનસિક પ્રવૃત્તિ, માણસને ક્રમે ક્રમે અધોગતિને પંથે લઈ જાય છે અને તેમાં ગેરફાયદાની પરાકાષ્ટા છે.

કોઈ ખરાબ ચીજનો સ્પર્શ બિનતંદુરસ્ત હોઈ, આપણે તરત જ હાથને પાણીથી ધોઈ સ્વચ્છ કરીએ છીએ. પણ દોષિત વિચારોથી બગડેલું મન, જે હાથ કરતાંય વિશેષ બગડેલું છે, તે સાફ કરવા આપણે ખાસ કંઈ કરતા નથી. માનવ જીવનની એ એક મોટી કમનસીબી છે. મનને

સ્વચ્છ, રચનાત્મક અને સુંદર વિચારોમાં પરોવવું એમાનસિક તંદુરસ્તીની નિશાની છે. આખરે મન પણ શરીરમાં જ વિધમાન છે. એટલે તંદુરસ્ત મન, શરીરને પણ તંદુરસ્તી બક્ષે છે અને સરવાળે માનવીનું જીવન ઉલ્લાસભર્યું, શાંત, પ્રસન્ન અને જીવવા જેવું બની રહે છે. ઈશ્વર તો પ્રત્યેક માનવીના હૃદયના ઉંડાણમાં વિધમાન છે જ. પણ દોષદર્શનની દુર્ગંધમાં તેને આપણે ગોંધી રાખીએ છીએ. જ્યારે સદાચારથી સુગંધિત આંતરીક વાતાવરણ અંતર્યામિની આસપાસ આપણે રાખીએ છીએ ત્યારે તે અંત્યત પ્રસન્ન થઈ માનવજીવન પર કૃપા અને આશીર્વાદ વરસાવે છે અને અનેક ઉન્નતિકારક ફાયદા બક્ષે છે, જે અનુભવે જ સમજી શકાય છે.

— સાભાર "આંતર્ધ્વનિ"

### પ્રિય વાચક મિત્રો,

ટપક માટે આપ, સહયોગ રાશિ મોકલી શકો છો. ટપકને મોકલવામાં આવનાર આ રકમ ચેક અથવા ડ્રાફ્ટ થી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રનાં નામે મોકલવા વિનંતી છે. આપની આસપાસ બનતા બનાવો કે જે બીજા લોકો માટે અનુકરણીય હોય તેની વિગતો ટપકને મોકલી શકો છો તેથી અન્ય લોકો તે વિશે માહિતગાર બનશે.

— ટપક ટીમ

બે ઘડીનો આશરો આજ છે કાલે નથી

## પ્રતિભાવ

શ્રી ધીરુભાઈ અને ટપક ટીમને સલામ.  
અંક મોકલવા બદલ આભાર. ધુમકેતુની માફક બે વર્ષે દેખા દીધી ટપક નવેમ્બર-૨૦૧૨ નો અંક મળ્યો. સાઈઝ નાની થતી જાય છે. ઉંમર મોટી થાય છે. નાના વાક્યોમાં શાસ્ત્રો શિખવી જાય છે. જીવવાનું-બોલવાનું અને વર્તન શીખવી જાય છે.

નોંધ-ધીરુભાઈ આપને મળવાની ઈચ્છા છે ક્યાં અને ક્યારે મળી શકાય. આપની પ્રવૃત્તિઓને અમારા વિસ્તારમાં લાવી શકાય એ માટે આપના સહકારની જરૂર જણાય છે પણ આપના ઉપર આધાર છે.

ટપક ટપક અવાજ આવે છે. પણ એ ચુંટણીના પ્રચારકોના ચંપલના અવાજ છે. ચુંટણી માતા આવે છે નવા વાયદા લાવે છે. ગરીબો ત્યાંને ત્યાં છે વચેટીયા મલકાય છે. પાંચ વર્ષ વહી જાય છે. છેલ્લો માસ દેખાય છે. વાતો કરનાર બદલાય છે. વાયદો ત્યાંને ત્યાં છે.

આભાર

ઈશ્વર યોગી, આશરા, ગઢ-પંચ, મુ.ગઢ ૩૮૯૧૨૦ પો: પરવડી, તા.ગોધરા જી.પંચમહાલ

## સેવાતીર્થ

સેવાતીર્થ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સ્વનિર્ભર બનેલા શ્રી મહેશભાઈ તથા કુ. મિનાક્ષીબેન એમ બે વિકલાંગોને રૂરલ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ દ્વારા શ્રીમતિ

નંદીનીબેન પી. દિવેટીયા રૂરલ રીહેબિલીટેશન એવોર્ડ ફોર ડિસેબલ્ડ-૨૦૧૨થી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં તેઓને પ્રમાણપત્ર તથા રૂપિયા દસ-દસ હજાર ના ચેક તા.૧/૧૨/૨૦૧૨ ના રોજ નંદિની નિલમય સંસ્કૃતિ સભાગૃહ, ગોતા, અમદાવાદ મુકામે ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી શ્રી સનતભાઈ મહેતાની ઉપસ્થિતિમાં મહેમાનશ્રીઓના શુભ હસ્તે અર્પણ કરવામાં આવ્યા.

## પરમ ધરમ પર્યાવરણ

નિરોગી રહેવું એ પર્યાવરણ ધર્મનો પ્રથમ અવિષ્કાર છે. નિરોગી વ્યક્તિ જ સારા વિચારો, સ્વસ્થ મન તથા કલ્યાણ ભાવ ધરાવી શકે છે. વનસ્પતિ તથા વૃક્ષો જેવા પવિત્ર અને નિસ્વાર્થ રહેવું એ પર્યાવરણ ધર્મની સ્વીકૃતિ છે. પર્યાવરણ એ કોઈ ધર્મ નથી પણ મનુષ્યો દ્વારા માનવામાં આવતા ધર્મોમાં પ્રકૃતિ એ એક સ્વીકૃતિ પથ છે.

## ક્ષેત્રિય કાર્ય

કુ. આન્યા બિનોઈભાઈ ગારડી ગ્રામ વિદ્યાપીઠ, બી.આર.એસ. કોલેજ, શારદાગ્રામના નીચે મુજબના ૪ (ચાર) વિદ્યાર્થીઓ આ માસમાં સંસ્થામાં ફીલ્ડ વર્ક માટે આવ્યા હતા.

૧. સરસ્વતી કાનાભાઈ ભાદરકા
૨. શીલ્પા ડાયાભાઈ ગોહેલ
૩. દેવી પુંજાભાઈ ચાવડા
૪. વિપુલ એસ. સુહાગીયા

યાદ આવે ત્યારે આપજો અને મોકલજો હું તો આવકારનો છોડીશ નહીં મલાજો

### Positive Attitude

Being in a good mood is not difficult. It does take a little work, and it also takes responsibility. Because it's better to be happy than upset, putting yourself in a good mood is definitely worth it.

Even the happiest of people find themselves in a bad mood now and then. Others unfortunately may find themselves in low spirits more often than not. The following tips can help both types of people create a better mood each day.

#### 1. TAKE INVENTORY

The first step is to realize you are in a bad mood. If you don't realize it, it's going to be tough to change it.

This realization can come from several sources. You are usually the best judge of your mood. You can also get that type of feedback from others.

#### 2. DECIDE TO CHANGE

Now that you know you are in a negative mood, you have to decide you want to change it. This isn't as easy as it sounds. When we're upset, we usually don't want to hear how we should be happy. We usually want to be left alone. That is why this is the toughest step.

Regardless, it's worth it. A few days a week in a bad mood can really add up. A friend might comment that you are usually in a negative mood without you even realizing it. Yes it's hard to make this decision, but after you have changed your mood, you'll be

happy you did.

#### 3. FIND THE SOURCE

You know you're not happy, and you want to change. The next step is to look for the source. I know that when things start piling up I get a little tense.

Once I feel that I am getting upset, I think about what things I am concerning myself with. Then I write them down, and get to work on them. This helps to bring order to my cluttered mind.

Look for the source of the negativity. Did someone say something that upset you? Are you worried about something that you did? About something you still have to do?

#### 4. FIX THE SOURCE

When you find the source, it's time to fix it. If someone upset you, talk with them. If you are worried about getting something done, do it. If you are worried about something you can't change, accept that you can't change it and move on.

#### 5. DO SOMETHING THAT MAKES YOU HAPPY

Sometimes fixing the source isn't enough to change our mood. In this case, think of things that put you in a good mood.

It could be anything that you choose. Calling a friend, going to lunch, playing golf, etc. If you fix the source of the problem and you still feel down, do something fun.

This quick system will help to change your down days into some of the best up days you've ever had.

**મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.**

## એકલનારી બહેનોની સફળ ગાથા



નામ:—કાળીબેન ભૂપાભાઈ ઢગલ/પરમાર

ગામ:— ધુંધવાણા

ઉંમર વર્ષ: ૫૮

ગીર વિસ્તારમાં આવેલ અમરેલી જિલ્લાના છેવાડાના ગામ ધુંધવાણા ખાંભાથી ઉના રોડ પર આવેલું છે. ધુંધવાણા ગામની વસ્તી આશરે ૧૨૦૦ છે. આ ગામ જિલ્લાના મુખ્ય માર્ગ પર આવેલ હોય મૂળભૂત માળખાકીય સવલતો ધરાવે છે. આ ગામમાં આહીર, રબારી, કોળી, દરબાર જેવી જ્ઞાતિઓ વસવાટ કરે છે.

શ્રી કાળીબેન ભૂપાભાઈ ઢગલનો જન્મ આ જ ગામમાં અને નાનપણથી જ તેઓ આ ગામમાં રહ્યા છે. તેમના લગ્ન પણ આજ ગામમાં રહેતા શ્રી ભૂપાભાઈ સાથે જ્ઞાતિના રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા. તેમનું સખરુપ લગ્નજીવન ૧૫ વર્ષ ચાલ્યું એ દરમિયાન તેઓ ૬ (છ) દિકરીઓની માતા બની ચુક્યા એવામાં તેમના પતિનું અવસાન થયું. પોતાના પરિવારની તમામ જવાબદારીઓ કાળીબેનના માથે આવી પડી.

વિધવા થયા તેને આજે ૨૪ વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. તેના પતિ ગુજરી ગયા ત્યારે તેમની નાની દિકરી રૂપલબહેનની ઉંમર ફક્ત ત્રણ માસ હતી. પતિના અવસાન બાદ તેમણે માતા અને પિતા બંને તરફથી જવાબદારીઓ નિભાવી અને તેમણે બધી દિકરીઓને ૪ થી ૧૨ સુધીનું શિક્ષણ પુરું પાડ્યું. દિકરીઓના શિક્ષણ તથા ભરણ પોષણ માટે મજૂરીએ પણ જવું પડતું હતું તેમ છતાં દિકરીઓની ઈચ્છા અનુસાર દરેકને ભણાવી.

કાળીબેન પોતે વિધવા હોવા છતાં પોતાની બધી દિકરીઓને લાડકોડ થી ઉછેરી હતી. તેઓ તેમની બધી દિકરી ઓને દિકરાની જેમ જ રાખતા હતા. કાળીબેને મુલાકાત દરમિયાન કહ્યું હતું કે મારી બધી જ દિકરીઓ મારા માટે દિકરા સમાન છે અને હું તેઓને દિકરાથી પણ વિશેષ ગણુ છું.

કાળીબેન ગ્રામ્ય વિસ્તારમાં રહેવા છતાં વિશાળ દ્રષ્ટિ ધરાવે છે. તેનું એક સરસ મજાનું ઉદાહરણ પ્રસ્તુત છે. આજથી ૧૦ થી ૧૨ વર્ષ પહેલાં ની વાત છે. ધુંધવાણા ગામમાં માધ્યમિક શિક્ષણની સુવિધા નથી. તેથી આગળ ભણવાનું થાય તો શહેર કક્ષાએ જવું પડે. આથી ધુંધવાણા ગામના લોકો છોકરાઓને બહાર જયા માધ્યમિક શિક્ષણ ની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં મોકલતા પરંતુ દિકરીઓને શિક્ષણ માટે કોઈ બહાર મોકલતું ન હતું.

**જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.**

એવામા કાળીબેનની મોટી દિકરીએ ગામમા આપવામા આવતુ શિક્ષણ પુરુ કર્યુ. હવે આગળ ભણવા માટે બહાર જવુ પડે, આથી કાળીબેને પોતાની દિકરી ને આગળ ના અભ્યાસ માટે ધુંધવાણાથી નજીક આવેલા ખડાધાર ગામમાં માધ્યમિક શિક્ષણ માટે મોકલીને સમગ્ર ધુંધવાણા ગામમાથી કન્યાઓને અભ્યાસ અર્થે બહાર મોકલવાની પહેલ કરી હતી. આજે કાળીબેનના આ હિંમતભેર કાર્યથી બીજા ગામલોકોએ પણ ડર ખંખેરીને પોતાની દિકરીઓ આગળ ભણે તે માટે બહાર મોકલતા થયા. હવે તેઓ સમાજની વાતો કે ટીકાઓની ચિંતા કરતા નથી. તેમની નિર્ણય શક્તિ ખુબ જ મક્કમ અને મજબુત છે.

હાલના સમયે પણ દિકરીઓને શિક્ષણ માટે બહાર મોકલવી તે જોખમભર્યુ ગણાય છે અને લોકો પણ આડા-અવળી વાતો કરે તે અલગ. પરંતુ આજથી ૧૦-૧૨ વર્ષ પહેલા કાળીબેને સમાજ કે સમાજ ની વાતો ની પરવા કર્યા વગર તેમની દિકરીઓને શિક્ષણ માટે બહાર જવાની પરવાનગી આપી તે ખૂબજ સમજપૂર્વકની હિંમત હતી.

આજે ૫૮ વર્ષની ઉંમરે કાળીબેન ધુંધવાણા ગામમાં પોતાના ભાઈના મકાનની બાજુમાં જ પોતાના અલગ મકાનમાં રહે છે. તેમની પાસે ઘેટા બકરા નથી પરંતુ ભેંસ અને ગાય હોવાના લીધે દુધ વહેંચીને પોતાની આજીવિકા મેળવે

છે. ગાય ભેંસ માટે ઘાસચારો ખરીદીને મેળવે છે. આથી તેમને હવે મજૂરીએ જવું પડતું નથી. તેમજ તેને વિધવા સહાય અંતર્ગત રૂ.૮૫૦/- દર માસે મળે છે. તેમજ તેમના પરિવારજનો પણ જરૂર જણાય ત્યાં કાળીબેનને આર્થિક તેમજ અન્ય મદદ કરે છે. કાળીબેનને તેના સમાજના લોકો ખૂબ જ માન સન્માન અને આદર આપે છે. કોઈ મહત્વનું કાર્ય કે શુભ પ્રસંગ હોય તો કાળીબેનને પુછીને તેમની સલાહ મુજબ કરવામાં આવે છે. તેમનો સમાજ તથા અન્ય સમાજ તેને માનભરી નજરે જુએ છે.

કાળીબેનની આ સફળગાથા/સંઘર્ષગાથામાં તેના કુટુંબીજનો તેના ભાઈઓ અને ગામના લોકોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. તેમની બધી જ દિકરીઓ સાસરામાં સુખી લગ્નજીવન વિતાવી રહી છે. આ બધુ કાળીબેનના મજબુત અને મક્કમ મનોબળનું જ પરિણામ છે. જો તેઓ સંઘર્ષ સમયે કે વિપરીત સ્થિતિમાં તેઓ હિંમત હારીને બેસી ગયા હોત તો કદાચ હકીકત થોડી અલગ જ હોત...!! પરંતુ તેમની હિંમત અને મહેનતથી તેઓએ સમાજમાં તેમજ કુટુંબમાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. અને પોતાના બળ ઉપર આર્થિક આજીવિકા મેળવી રહ્યા છે.

શ્રી કાળીબેનએ એકલનારી કાર્યાળામા ઉપરોક્ત બાબતો જોશભેર જણાવી હતી.

— પ્રતિભા માડુ

ઘરનાં સભ્યોનો સ્નેહ ડોક્ટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.

## એકલનારી કાર્યશાળા

એકલનારી શક્તિમંચ—ગુજરાત રાજ્યમાં ૧૩ જિલ્લાઓમાં કામ કરી રહ્યું છે. આ મંચની કામગીરી અમરેલી જિલ્લામાં શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રના સહયોગમાં ચાલી રહી છે. ૨૪ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર દરમિયાન ચાલેલ અભિયાન બાદ એકલનારી બહેનોની સમસ્યાઓને ધ્યાનમાં લઈ એક કાર્યશાળાનું આયોજન અમરેલી મુકામે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત એકલ બહેનોની નોંધણી બાદ કાર્યશાળાની શરૂઆત સૌને આવકાર આપી સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ધીરૂભાઈ વાગડીયાએ એકલ મહિલાઓની સમસ્યાઓ શું છે તેની વિગતો એકલ મહિલાઓ પાસેથી જાણી હતી. તેમની સમસ્યાઓ એ હતી કે ઉંમર વધતા કામમાં મુશ્કેલી અનુભવાય છે, સંતાનમાં માત્ર દિકરીઓ જ છે, કોઈ પણ સહારો નથી, બાળકો નાના છે, બિમારીથી કામ થતું નથી, વિધવા સહાય મળતી નથી જેવા વગેરે પ્રશ્નો બહાર આવ્યાં હતા. એકલનારી બહેનોના આવેલ પ્રશ્નોના નિવારણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી રેણુકા કુંભાણી (એડવોકેટ, મહિલા કાનુની માર્ગદર્શન કેન્દ્ર) એ એકલનારી બહેનોની મુશ્કેલીઓમાં કાયદાકીય મદદો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે ૬૦

વર્ષથી ઉપરના બહેનોના કાયદાઓ અને ૬૦ વર્ષથી નીચેના બહેનોના કાયદાઓ વિશે વિગતે સમજાવ્યું હતું. જમીન માલિકી અધિકાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે જમીન મિલકતનો હક સ્ત્રીઓને પિયરમાંથી અને સાસરીમાંથી મળી શકે છે. તે હક માંગવાનો તેને પૂરો અધિકાર છે. ઉપસ્થિત રહેલ બહેનોના વ્યક્તિગત પ્રશ્નો સાંભળવામાં આવ્યાં હતાં. તેમાં સવિતાબેન જીકાદ્રાએ જે મૂળ ખડાધારના વતની છે તેમનો પ્રશ્ન એ હતો કે તેમને દિયર જેઠ જમીનમાં ભાગ આપતા નથી અને તેના પ્રશ્નોનો જવાબ આપતા રેણુકા બહેને જણાવ્યું હતું કે તમારો અધિકાર છે મિલકતમાં ભાગ માંગવાનો અને તે તમને મળવો જ જોઈએ. તે માટે જરૂરી કાયદાકીય મદદ કરવા તેઓએ જણાવ્યું હતું. તેના વક્તવ્યમાં તેમણે જણાવ્યું હતું કે માં પણ કહ્યા વગર જમવાનું પીરસતી નથી તો કાયદાઓ આપણા માટે જ છે અને કાયદાઓનો લાભ આપણે જાતે જ લેવા કુશળતાઓ કેળવવી પડશે. જાગૃત બનીને તમારો અધિકારો તમારે જ મેળવવો પડશે.

આ કાર્યશાળામાં અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાં ફરજ બજાવતા શ્રી ભૂમિકા દેસાઈ (પ્રોટેક્શન ઓફીસર) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એકલનારી બહેનોને સહાય કરતી યોજનાઓ વિશે વિગતે માહિતી આપી હતી. તેણે વિધવા વિકલાંગ સહાય વિશે જણાવતા

**આવજો અને બોલાવજોને સાથે રાખજો.**

કહ્યું હતું કે વિકલાંગ બહેનો માટે મકાન સહાયની સુવિધા ઉપરાંત જે યોજનાઓ વિધવા બહેનોના વિકાસ માટે હોય છે તેની જાણકારી રાખી આ યોજનાનો લાભ દરેક એકલ બહેનોએ લેવો જોઈએ. આ બાબતે મારી કચેરીની મુલાકાત લઈને તમે વધુ વિગતો મેળવી શકશો તેમજ જ્યાં પણ અમે તમોને ઉપયોગી થઈ શકીએ ત્યાં અમને ચોક્કસ જણાવશો તેમ જણાવ્યું હતું.

ભોજન વિરામ બાદ શ્રી બિપીનભાઈ જોષી (નિવૃત્ત વિજ્ઞાન શિક્ષક, ફોરવર્ડ હાઈસ્કૂલ તથા સામાજિક કાર્યકર) એ એકલનારી બહેનોની સમસ્યા ઉપર વાત કરતાં જણાવ્યું હતું કે વિધવા/ત્યકતા બહેનોની સમસ્યાઓ પર આજે

આપ સૌ ભેગા થયા છો તે તમામ બહેનોને હું અભિનંદન આપુ છું આ સંસ્થાના નેજા હેઠળ આપની સંગઠન શક્તિ ચોક્કસ વિકસે તે માટે આપણે બધા સાથે મળીને આયોજન કરીએ. આપના અન્યાયકર્તા દરેક પ્રશ્નોને આપણે યોગ્ય પ્લેટફોર્મ પર રજુ કરવા માટે મારી પણ જ્યાં જરૂર જણાય ત્યાં મને પણ સાંકળશો તેમ જણાવ્યું હતું. રેણુકાબહેન, બીપીનભાઈ, વિજયાબેન સાથે રહી ઉપસ્થિત એકલ બહેનોએ આયોજન કર્યું હતું.

અંતમાં સૌ બહેનો સમૂહમાં સંગઠન ગીતનું ગાન કરી તેમજ નારા બોલાવીને છુટા પડ્યા હતા.



મન મરે માયા મરે મર મર જાય શરીર આશા તૃષ્ણા ન મરે એ કહી ગયા કબીર

**Engage on this month**

- 27-10 Campaign for Rights of single women  
2 Team meeting at Amreli Office.  
11-12 SKVAW reviw & planning Meeting at Ahmedabad  
12-14 BRGF training at SPIPA-Ahmedabad  
20 Meeting with centre of micro fianance at Amreli  
21 Rally for Single Women-Khambha  
27 Meeting for Gram Sanjivni Samiti Phase-3 At Ahmedabad  
28 Zonal Workshop on SHG Bank linkage-Rajkot  
28-29 Ekalnari Sammelan-Ahmedabad

**Happy birthday**

1. Dayabhai P. Patel 01-01-40  
2. Sonal J. Madviya 02-01-76  
3. Paresh J. Thakar 05-01-75  
4. Ajitbhai B. Jadav 07-01-78  
5. Ranjit A. Govaliya 07-01-86  
6. Pravinkumar Sarvaiya 08-01-78  
7. Rajiv M. Chandapa 08-01-91  
8. Govind D. Rathod 11-01-87  
9. Arvindkumar R. Javiya 12-01-73  
10. Rajesh D. Rathod 12-01-92  
11. Khyati M. Dhruv 16-01-91  
12. Hetal S. Prajapati 21-01-86  
13. Ashvinkumar D.Barad 24-01-91  
14. Arshibhai C.Solanki 26-01-88  
15. Ramaben Makvana 31-01-65

**માહિતી અધિકાર હેલ્પલાઈન : ૯૯૨૪૦૮૫૦૦૦**

Printed, published and edited by Hardik Dhirajlal Vagadia on behalf of Educational & Social Welfare Centre, Published from Tapak Karyalay, 26-Omnagar-3, Hanumanpara Road, Amreli and printed at Geeta Graphics, F-1 Sahjanand market, Station road, Amreli.

**Post Reg. No. L2/41/G-AMR-91/RNP/2012**  
**Valid Upto 31/12/2014**

**RNI No. GUJGUJ/1999/01521**  
**Date Of Issue 1<sup>st</sup> of month**



Book -Post, Printed Matter

ટપક કાર્યાલય :

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર,  
૨૬,ઓમનગર(૩), હનુમાનપરા રોડ,  
ગોકુલ પાર્ક સામે, અમરેલી-૩૬૫ ૬૦૧.

Tel/Fax : 02792-223525

E-mail : tapak@sskkamreli.org website: www.sskkamreli.org

**જુંદગીનો શો ભરોસો આજ છે કાલે નથી**